

## પરિષદ-પ્રમુખનો પત્ર

### જે વોણિંગનમાં ઓ સુરતમાં

આજે ફરીથી અહીં સોનેટના કાવ્યપ્રકાર વિશે લખવા ધારું છું. ગઈ તા. વીસમી ફેબ્રુઆરીએ મુંબઈમાં અમેરિકાનિથિત ગુજરાતી કવિ નટવર ગાંધીના ત્રીજી કાવ્યસંગ્રહ પેન્સિલવેનિયા એવેન્યુના લોકાર્પણ-કાર્યક્રમમાં હાજરી આપવાનું બન્યું. નટવર ગાંધી અછાંદસ, લયાત્મક વગેરે પ્રકારોમાં તો કાવ્યો લખે જ છે. સોનેટનો કાવ્યપ્રકાર પણ એમને એકદ્વારા કંઈક કલમવગ્નો ગણાય. તેમનાં પત્નીના અવસાને જગાવેલી તીવ્ર સંવેદનાની અનુભૂતિને વ્યક્ત કરવા માટે એમને સોનેટનો કાવ્યપ્રકાર સર્વાધિક અનુકૂળ લાગ્યો. ‘પેન્સિલવેનિયા એવેન્યુ’માં પત્નીવિરહનાં સોનેટોનું એક ગુચ્છ ધ્યાનાર્દ બન્યું છે.

સહેજ અંગત ઉલ્લેખ પણ વિનમ્રભાવે જોડી રહ્યે છે :

બે વર્ષ પહેલાં મારાં પત્નીનું સાવ અણાયિતલ્યું અવસાન થતાં મારું સંવેદનતંત્ર તીવ્ર શોકાનુભૂતિથી રણજાળી ઉઠ્યું હતું. કવિતાક્ષેત્રે મારી મુખ્ય ગતિ ગુજરાતના પ્રકારમાં રહી છે તે એકદ્વારે સુવિદ્ધિ છે. પત્નીવિરહથી આંદોલિત મારું ચિત્તતંત્ર પ્રારંભે શોકોર્મિસ્યુચક ગુજરાત લખવામાં પ્રવૃત્ત થયું ન થયું ત્યાં હું, મારીયે કશી સરત વિના સોનેટ ભાણી વળ્યો અને પણી તો સોનેટ-સર્જનના પ્રવાહથી પરિપ્લાવિત બન્યો. ફલશ્રુતિ રૂપે દસ મહિનામાં બોરેર શોકોર્મિસ્યુચક સોનેટો રચાયાં.

જે અકળ કાવ્યસર્જનલીલા અહીં સુરતમાં એ જ – હજારો માઈલ દૂર વોણિંગના એક કવિહદ્યમાં પણ સક્રિય બની. નટવર ગાંધીએ પણ પત્નીવિરહની શોકાનુભૂતિની અભિવ્યક્તિ માટે સોનેટના માધ્યમને અપનાયું, પલોટયું.

અહીં મારે જે ભારપૂર્વક કહેવું છે તે આટલું : એકથી વધુ કાવ્યપ્રકારોમાં કામ કરી શકતો કવિ કોઈ વિશિષ્ટ અનુભૂતિની અભિવ્યક્તિ માટે તેને અનુરૂપ એવા કાવ્યપ્રકાર ભાણી વળે છે અને એમાં પ્રવૃત્ત થઈ કંઈક ઈષ્ટ કાવ્યપરિણામ સાધી શકે છે. નટવર ગાંધી અછાંદસ કે લયાત્મક પ્રકાર દ્વારા શોકોર્મિસ્યુચક રચનાઓ કરી શક્યા હોત. મારી ગુજરાતી વધારે ફાવટ. પરંતુ અમે બંને ચોક્કસ અને સમાન અનુભૂતિની અભિવ્યક્તિ માટે સોનેટ ભાણી વળ્યા અને ઢળ્યા તે આ કાવ્યપ્રકારની વિશિષ્ટ અભિવ્યક્તિ-ક્ષમતાની વોતક ઘટના લેખાય.

દિવંગત ગુજરાત આદિલ મન્સૂરી ગુજરાતી ઉપરાંત ઉર્દૂના પણ ઉમદા કવિ હતા. તેમણે અઢળક ગુજરાતી ગુજરાતી લખી છે. ઉર્દૂમાં તેમણે ગુજરાતી ઉપરાંત કેટલીક આજાદ નાઝમોનું પણ સર્જન કર્યું છે. આદિલે તેમના દિવંગત વાલિદસાહેબનું સ્મૃતિચિત્ર આવેખતી એક અદ્ભુત ઉર્દૂ નાઝમની રચના કરી હતી. ક્યારેક એ તેઓ મુશાયરામાં રજૂ કરતા. અહીં નોંધનીય મુદ્રા એ છે કે શોકોર્મિસ્યુચક રચના માટે આદિલસાહેબે જે

પંક્તિના શેરોની માળા નહિ પણ કંઈક વધારે પંક્તિઓમાં વિસ્તરાતું નાઝમનું માળખું પસંદ કર્યું અને તે દ્વારા તેમણે કાવ્યસિદ્ધિનું લક્ષ્ય વીંધ્યું.

પ્રત્યેક પ્રકારની નોખી-નોખી વિશિષ્ટતા તો હોય જ. ગુજરાતના શેરની બે પંક્તિમાં જે કંઈક સૂચવાય છે એ મહાકાવ્યનો એક પણ સંભવી શકે. પરંતુ ગુજરાતના શેર, દુહા કે હાઈકુમાં કંઈક દીર્ઘ અભિવ્યક્તિને અવકાશ નથી. ત્યારે આખ્યાનકાવ્ય, ખંડકાવ્ય, નાઝમ વગેરે કાવ્યપ્રકારોમાં બૃહદ, વિસ્તૃત અનુભૂતિને વ્યક્ત કરવાની મોકળાશ રહે. એકાંકી અને બહુઅંકી નાટક, લઘુકથા અને વાર્તા, લઘુનવલ અને બૃહનવલ — આ બધા દેખીતા એક કુળના છતાં અનુભૂતિની જુદીજુદી તરેહને વ્યક્ત કરવા માટેનાં પ્રકારો છે. સોનેટ શેર, દુહા કે હાઈકુ જેવું આત્તિલઘુ નહિ તેમ આખ્યાનકાવ્ય કે ખંડકાવ્ય જેવું વિસ્તીર્ણ કાવ્યસ્વરૂપ પણ નથી. તે ઊર્મિકાવ્યનો જ એક પ્રકાર હોવા છતાં તેનો ચુસ્ત બંધ અને વિશિષ્ટ સંવિધાન તેની ખસૂસ વિશેષતા છે. અનુભૂતિના કંઈક મોટા સ્કુલિંગો, બારીક કથાતત્ત્વ, પરાકાણ ઈત્યાહિને તેમાં ખાસ્યો અવકાશ છે. ક્રૈંટ્યુલિક અને વૈયક્તિક સંબંધોની અનેક ભાતો ઉપસાવવા માટે આ પ્રકાર ઘણો અનુકૂળ જણાયો છે. આપણા અનેક સિદ્ધ સોનેટકવિઓનાં તેવાં સોનેટોનો નિર્દેશ કરી શકાય. તત્કાળ તો મને કવિ ઉશનસ્સાં માતા-પિતા વિષયક સોનેટો સ્મરણો ચઢે છે.

કવિ તેના કોઈ વિશિષ્ટ અનુભૂતિની અભિવ્યક્તિનું પૂરેપૂરું કાર્યસાધક માધ્યમ પસંદ કરે તે કાવ્યલક્ષ્યની સિદ્ધિનું તેનું પ્રથમ અને સફળતાની લગભગ ખાતરી આપતું સોધાન કહી શકાય. પાણી જેમ તેનો યોજ્ય ઢળ કે પાત્ર શોધી લે છે તેમ કવિચિત્તની અનુભૂતિ ચોપોચપ બંધબેસતી અભિવ્યક્તિના પાત્રમાં ઢળી જાય એટલે પ્રાથમિક કાર્ય સિદ્ધ થયેલું ગણાય. પણ આવો મણિકાંચનયોગ કાંઈ રમતવાતમાં કે કશી અંતરિક સજ્જતા વિના સધાઈ ન શકે. તે માટે કવિએ તેના ચિત્તતંત્રે અને સર્જકશક્કિને સટૈન ઉદ્યત તથા મોકળાં રાખવાં જોઈએ. આવી અંતરિક સર્જનપ્રક્રિયા કવિચિત્તમાં નિરંતર ચાલતી રહે તો તે તેના લક્ષ્ય સુધી પહોંચવાની આશા રાખી શકે. એક વાર આ પ્રથમ પગથિયું ચન્દ્યા પછી કવિએ તેની સર્વ સર્જશક્કિને કામે લગાડી કાવ્યસિદ્ધ માટે મથવું પડે.

તા. ૨૪-૨-૨૦૧૧

ભગવતીકુમાર શર્મા